



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩

કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦



તા.૧૭/૦૮/૨૦૧૮ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૮૧૧/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૮૩ કેસ કરી, ૮૨ વ્યક્તિઓને ઝડપી, ૧૭૮ લીટર દેશી દારૂ, ૧૬૭ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧૨૭ બિયર ટીન, ૧ પીકઅપ ડાલુ અને ૨ સ્ફૂટર કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૧૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૯,૩૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૮૧૨/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી ૯૩ મુજબ ૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૮૧૩/૧૮

નરોડા: સિધ્ધાર્થભાઈ મનોજકુમાર સથવારા (રહે.યશ પ્લેટિના રાધે-૨ સામે હરીદર્શન ચાર રસ્તા નરોડા) એ તા.૧૬/૮/૧૮ નારોજ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૦૭/૧૮ થી આજદીન સુધીના સમયગાળા દરમિયાન આરોપી (૧) ગોપાલભાઈ ગોવાભાઈ ભરવાડ અને (૨) મહેશભાઈ ગોગાભાઈ ભરવાડ નાઓએ ભેગા મળી તેઓની નરોડા ગેલેક્ષી સિનેમા સામે ગેલેક્ષી એવન્યુ પાછળ ઇ/૪૦૫/૨, ઓફિસ ખાતે ડ્રો સ્કીમની લોભામણી સ્કીમ યોજી, સિધ્ધાર્થભાઈના રૂપિયા ૫૦,૦૦૦/- મેળવી લઈ નાણા પરત નહી આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી રમેશભાઈ અમૃતભાઈ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૮૧૪/૧૮

અમરાઈવાડી: ભાર્ગવભાઈ સ/ઓ ગાંડાભાઈ પટેલ (રહે,ત્રિદેવપાર્ક સોસાયટી સહજાનંદ સ્કુલ પાસે મહાદેવનગર ટેકરા વસ્ત્રાલ) એ અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૬/૦૮/૧૮ કલાક ૫/૦૦ વાગ્યાના સુમારે અમરાઈવાડી અમી અંખડ આંનંદ સોસાયટી વિભાગ-૧ માં આવેલ એફ/૨૦ અને એફ/૨૧ નંબર વાળી “કુલ પોઇન્ટ” નામના ઇલેક્ટ્રીક શો રૂમનુ શટર ઉંચુ કરી અજાણી વ્યક્તિ શોરૂમમાં પ્રવેશ કરી જુદી-જુદી કંપનીના મોબાઇલ ફોન નંગ-૨૦ કિમત રૂપિયા ૨,૮૪,૬૭૫/- અને રોકડ રૂપિયા ૨,૬૯,૦૦૦/- મળી કુલ રૂપિયા ૫,૫૩,૬૭૫/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી ઓ.એમ.દેસાઈ ચલાવે છે.

મણીનગર: રંજનબહેન વા/ઓ પ્રભાશંકર વ્યાસ (રહે.કંચનવાટિકા એજલ સ્કુલવાળી ગલી એલ.જી.હોસ્પીટલ વકીલવાડી મણીનગર) એ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૦૯/૧૮ કલાક ૧૦/૩૦ થી તા.૧૬/૦૯/૧૮ કલાક ૮/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના પાછળના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી સોનાના પાટલા નંગ-૨ કિમત રૂપિયા ૮૫,૦૦૦/-, સોનાની ચેઇન પેડલ સાથે નંગ-૧ કિમત રૂપિયા ૩૫,૦૦૦/-, ચાંદીની થાળીનો સેટ નંગ-૨ કિમત રૂપિયા ૫,૦૦૦/-, ચાંદીના સિક્કા નંગ-૪ કિમત રૂપિયા ૧,૦૦૦/-, દુરબીન નંગ-૧ કિમત રૂપિયા ૧૭,૦૦૦/- અને રોકડ રૂપિયા ૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૯૩,૦૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એન.પરમાર ચલાવે છે.

અપમૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૮૧૫/૧૮

દાણીલીમડા: અમરલપાલસિંહ રવિન્દ્રસિંહ (ઉ.વ.૪૫)(રહે,ઇન્દીરાનગર લાંભા તા.દસકોઇ જી.અમદાવાદ) તા.૧૬/૦૯/૧૮ સાંજના ૫/૩૦ વાગ્યાના સુમારે કોમલ ફેબ.પ્રા. લીમી.રાણીપુર પાટીયા નારોલ ખાતે ગેટ-૨ નો લોખંડનો રોલિંગ ગેટ બંધ કરતા હતા ત્યારે ગેટ અમરપાલસિંહ ઉપર પડતા ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી પ્રધાનજી ખેંગારજી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૮૧૬/૧૮

શહેરકોટડા: મહેશભાઈ રણછોડભાઈ મકવાણા (ઉ.વ.૩૫) (રહે.લલ્લુ ભગવાનદાસની ચાલી વિજયમીલ પાસે નરોડા ફાયર સ્ટેશન સામે નરોડા રોડ) એ અગમ્ય કારણસર તા.૧૬/૯/૧૮ સવારના ૮/૩૦ વાગ્યાના સુમારે નરોડા ફુટ માર્કેટ માટિ એસ્ટેટ નાળીયામાં શેડ નં.સી/૧૩૫ ખાતે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી દિલીપકુમાર વસંતલાલ ચલાવે છે.

ઓઢવ: રામવતીદેવી ઉર્ફે પ્રીતી વા/ઓ રાજેન્દ્ર રાય (ઉ.વ.૩૫) (રહે. ભગવતીનગર જયપ્રકાશ જૈનના ગુજરાત વેપારી મહામંડળની બાજુમાં સીંગરવા ઓઢવ) એ અગમ્ય કારણસર તા.૧૫/૯/૧૮ સાંજના ૭/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતના હુકમાં સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી કાંતીભાઈ જીવાજી ચલાવે છે.

અમરાઇવાડી: પારૂબહેન વા/ઓ બાબુભાઈ પરમાર (ઉ.વ.૫૭)(રહે.ડબ્બાવાળી ચાલી સત્યમનગર અમરાઇવાડી) એ ગંભીર બિમારીથી કંટાળી તા.૧૫/૦૯/૧૮ રાતના ૮/૩૦ વાગ્યાના સુમારે પોતાની જાતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી સળગી જઇ આત્મહત્યા કરી હતી. આ અંગે અમરાઇવાડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એન.એસ.પરમાર ચલાવે છે.

રામોલ:ભુપેન્દ્રભાઈ નરેન્દ્રબહાદુર ચોહાણ (ઉ.વ.૨૮)(રહે.સિતાનગર શિવશક્તિનગર પાછળ રામરાજ્યનગર રામોલ) એ અગમ્ય કારણસર તા.૧૫/૦૯/૧૮ સાંજના ૫/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પાઈપ સાથે દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી અમુતભાઈ મોહનભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.